



शोपिंग मोल

COVID-19 अटकायत माटे मार्गदर्शन

1. તમામ કન્ટેન્ટમેન્ટ / કલસ્ટર વિસ્તારના શોપિંગ મોલ બંધ રહેશે, ફક્ત કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
2. ૬૦-૬૫ વર્ષથી વધુ વયના વ્યક્તિઓ, કોમોર્બીડીટીઝ વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષ થી નીચેના બાળકોને ઘરે રહેવા સલાહ આપવામાં આવે છે. શોપિંગ મોલ તરફથી પણ તે અંગે જરૂરી સલાહ આપવાની રહેશે.
3. COVID-19 અંતર્ગત કેટલાક જરૂરી સૂચનો દરેક સ્ટાફ તેમજ પાલન કરાવાના રહેશે.
  - બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર રાખવાનું રહેશે.
  - ફરજિયાત માસ્ક / ફેસ કવર નો ઉપયોગ કરવો.
  - ૪૦ થી ૬૦ સ્કેન્ડ સુધી હાથ ધોવા. આલ્કોહોલ બેઇઝ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  - ખાંસી કે છીક ખાતી વખતે મોઢા ઉપર રૂમાલ કે ટીસ્યુ રાખવું તેમજ તરત જ તેને ડીઝપોઝ કરવું.
  - પોતાની આરોગ્ય ચકાસવું તેમજ માંદગી જણાય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરવો / નજીકના હેલ્થ સેન્ટર વિગેરેનો સંપર્ક કરવો.
  - જાહેરમાં થુકવું નહિ.
  - દરેક ગ્રાહક / સ્ટાફ પાસે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો.
4. શોપિંગ મોલમાં નીચે મુજબનું આયોજન કરવાનું રહેશે.
  - એન્ટ્રન્સ પર સેનેટાઈઝર અને થર્મલ સ્કેનર ફરજિયાત મુકવા અને હાઇજીન મેન્ટેન કરવું.
  - ફક્ત સિમટમ્સ નહિ ધરાવતા મુલાકાતીઓ અને ગ્રાહકોને પરવાનગી આપવામાં આવશે.
  - તમામ મુલાકાતીઓ અને ગ્રાહકોને શોપિંગ મોલની અંદર ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે.
  - પોસ્ટર્સ / સ્ટેન્ડીઝ / ઓડિયો-વિઝીયલ માધ્યમ થી **COVID-19** ની સલામતી અંગે ના ઉપયો દર્શાવાના રહેશે.
  - મોલમાં મેનેજમેન્ટ માટે તેમજ સોશ્યલ-ડિસ્ટન્સિંગ પાલન માટે જરૂરી માણસ રાખવા.
  - સોશ્યલ - ડિસ્ટન્સિંગ ફરજિયાત પાલન કરવાનું રહેશે.
  - મોટી ઉંમરના કર્મચારી, ગર્ભવતી મહિલાઓ તેમજ મેડીકલ કંડીશનમાં હોય તેવા મુલાકાતીઓ અને ગ્રાહકોને પબ્લિક સીધા સંપર્કમાં આવવા દેવા નહીં.
  - પબ્લિક પાર્કિંગ પ્લેસ અને વધુ વ્યક્તિઓ ભેગા થતા હોય ત્યાં સોશ્યલ-ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરાવવા આયોજન કરવાનું રહેશે.

- જો પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોય તેવા કિસ્સામાં ઓપરેટીંગ સ્ટાફે ફરિજયાત માસ્ક પહેરવું. ગાડીઓના ડોર હેન્ડલ, ચાવીઓને ડીસ ઈનફેક્ટ કરવાનું રહેશે.
- દુકાનો, સ્ટોલ્સ તેમજ કેફેટેરિયાની અંદર અને બહાર સોશ્યલ - ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે.
- લાઈનમાં ઉભી રહેતી વખતે બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ નું અંતર રાખવાનું રહેશે.
- સ્ટાફ, મુલાકાતીઓ, ગ્રાહકો અને ગૂડસ સપ્લાય માટે અલગ-અલગ એન્ટ્રી-એક્ઝીટની વ્યવસ્થા કરવાની રહેશે.
- માલસમાનની હેરફેર વખતે કાળજી રાખી, વારંવાર ડીસઈનફેક્ટ કરવાનું રહેશે.
- શોપિંગ મોલમાં દુકાનમાં ઓછામાં ઓછા દાખલ થાય તેની તકેદારી રાખવી, સોશ્યલ - ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરાવવાનું રહેશે.
- કાપડના નેપકીનને બદલે ડીઝપોઝેબલ નેપકીન વાપરવા વધુ હિતાવહ છે.
- લીફ્ટમાં માણસની સંખ્યા મર્યાદિત રાખવા આયોજન કરવાનું રહેશે.
- એસ્કેલેટર પર એક વ્યક્તિ છોડી ને ઉભા રહેશે.
- એરકંડીશનનું ટેમ્પરેચર ૨૪ થી ૩૦ સેલ્શીયસ રાખવું.
- મોટા મેળાવડા / વધુ લોકોને ભેગા થવું પ્રતિબંધિત છે.
- શોપિંગ મોલના બાથરૂમ, વોશિંગ સ્ટેશન અને પાણી પીવાની જગ્યાને વારંવાર સેનેટાઈઝ કરાવવાનું રહેશે.
- જાહેરમાં બર્થડેની ઉજવણી પર પ્રતિબંધ છે.
- ફેસ કવર માસ્ક અને ગોલ્ઝ પહેર્યાની ચકાસણી જે તે માલિકે કરાવવાની રહેશે.
- બાથરૂમની સફાઈ સમયાંતરે કરાવવાની રહેશે.
- ફૂડકોર્ટમાં.....
  1. સોશ્યલ - ડિસ્ટનસિંગ ફરિજયાત પાલન કરવાનું રહેશે તેમજ પૂરતા પ્રમાણમાં માણસને પ્રવેશ આપવો.
  2. ફૂડકોર્ટ અને રેસ્ટોરન્ટમાં ૫૦% વધુ કેપેસિટીમાં વ્યક્તિઓ આવવા દેવા નહિ.
  3. ફૂડકોર્ટ ના સ્ટાફ અને વેટરએ માસ્ક અને ગોલ્ઝ ફરજિયાત પહેરવા.
  4. ડીઝીટલ માધ્યમ થી ચુકવણી કરવાનો આગ્રહ રાખવો.
  5. દરેક કસ્ટમર પછી ટેબલને સેનેટાઈઝ કરવું.
  6. રસોડામાં પણ સોશ્યલ - ડિસ્ટનસિંગ ધ્યાન રહે અને ફેસ માસ્ક અવશ્ય પહેરવા.

- ગેમિંગ આર્કેડ તેમજ બાળકોને રમવાની જગ્યા માટે પ્રતિબંધ રહેશે.
- મોલમાં સિનેમા હોલ સંપૂર્ણપણે બંધ રાખવાના રહેશે.
- જો કોઈ શંકાસ્પદ કે કન્ફોર્મ કેસ આવે તો.....
  1. એ વ્યક્તિને અન્ય એક રૂમ માં આઈસોલેટ કરવી.
  2. ડોક્ટર તપાસ કરે ત્યાં સુધી ફેસ પર ફીરજીયાત માસ્ક પહેરી રાખવું.
  3. નજીકના ક્લીનિક કે હોસ્પિટલમાં તરત જ જાણ કરવી કે ડીસ્ટરીક હેલ્થ લાઈન ને જણાવવું.
  4. પબ્લિક હેલ્થ ઓથોરીટીએ જરૂરી કાર્યવાહી કરવી અને કોન્ટેક્ટ ટ્રેસીંગની કામગીરી કરવી.
  5. જો પોઝિટીવ કેસ મળે તો તરતજ પ્રીમાસીસને ડીઝઇન્ફેક્ટ રાખવું.

\* \* \*